



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૧/૧૨/૨૦૧૮ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૬૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૬૩ કેસ કરી, ૫૬ વ્યક્તિઓને ઝડપી, ૧૭૧ લીટર દેશી દારૂ અને ૧ સ્ફટક કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૬૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૬૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૧૨ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૨૪૬૮/૧૮

વેજલપુર: નયનભાઈ ભરતકુમાર ભગત (રહે.કાદંબરી સોસાયટી જીવરાજ પાર્ક સોસાયટી સામે વેજલપુર) એ તા.૨૦/૧૨/૧૮ નારોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૬/૧૨/૧૭ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી નિખીલ જયેદ્રભાઈ વ્યાસ (રહે.મણીલાલપાર્ક નોબલ વિદ્યાલય સામે કઠવાડા રોડ નવા નરોડા) એ નયનભાઈ પાસેથી તેમની સેકેન્ડ હેન્ડ હોન્ડા સીટી ગાડી નંબર જીજે.૨૭.સી.૧૬૦૫ કિંમત રૂપિયા ૪,૩૧,૦૦૦/- ખરીદ કર્યા બાદ તે પેટે લેવાના બાકી નિકળતા રૂપિયા ૩,૫૦,૦૦૦/- આજદિન સુધી નહીં ચુકવી નયનભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.કે.બરૈયા ચલાવે છે.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૨૪૬૯/૧૮

વટવા: ભગવતીભાઈ શંભુભાઈ અમીન (રહે. રાધીકા બંજ્લોઝ કેડીલા બ્રીજની બાજુમાં ઘોડાસર વટવા) એ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૧૨/૧૮ કલાક ૨/૩૦ થી સવારના ૭/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના રસોડાની ગ્રીલ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૬,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૭૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એચ.વી.સીસારા ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૨૪૭૦/૧૮

વસ્ત્રાપુર: ડો.નિધીબહેન ડો/ઓ જયેશભાઈ વ્યાસ (રહે.માત્રુછાયા પટોળાવાળાની શેરી ત્રીશેરીય સાલ્વીવાડો પાટણ) એ તા.૧૫/૧૨/૧૮ બપોરના ૩/૦૦ વાગે જી.એમ.ડી.સી ગેટ સામે જલારામ પરોઠા હાઉસ સામે ફલાવર હોસ્પિટલ નજીક પોતાની હ્યુન્ડાઈ કંપનીની ઈયોન કાર નંબર જીજે.૨૪.કે.૩૭૫૨ કિમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી એક કલાકમાં થઈ હતી. આ અંગેની ફરીયાદ ડો.નિધીબહેન વ્યાસે તા.૨૦/૧૨/૧૮ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એચ.જાડેજા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.